

:- અખબારી યાદી:-

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે ઇમુ પક્ષીએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો

મેયરશ્રી ડૉ પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા તેમજ
બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેનશ્રી અનીતાબેન ગૌસ્વામીએ આપેલ માહિતી

તારીખ: ૧૦-૦૬-૨૦૨૨

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૨૫ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. તાજેતરમાં જ સફેદ વાઘણે ૦૨(બે) વાઘ બાળને જન્મ આપ્યો હતો. હવે આવા જ વધુ એક સમાચારમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ઇમુ પક્ષીએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો અને અત્યારે આ ત્રણેય બચ્ચા ત્રણ માસની ઉમરના થઈ ગયેલા છે તેમ મેયરશ્રી ડૉ પ્રદિપ ડવ , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ , મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા તેમજ બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેનશ્રી અનીતાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું.

ઝૂ ખાતે ઇમુ પક્ષીએ બચ્ચાવનો જન્મ. :

રાજકોટ ઝૂ ખાતે પ્રથમ વખત તા.૨૪/૦૭/૨૦૧૫ના રોજ ઇમુ પક્ષીની જોડી (નર તથા માદા) રેસ્કઝયુ અર્થે મેળવવામાં આવેલ. આ બંને પક્ષીઓને અહીંનું કુદરતી જંગલ સ્વચરૂપનું વાતાવરણ અનુકૂળ આવી જતા ચાલુ વર્ષે નર માદાના સંવનનથી માદા ઇમુ દ્વારા ઇંડા મુકવામાં આવેલ. સામાન્ય રીતે ઇમુ પક્ષીઓમાં માદા પક્ષી ઇંડા મુક્યા પછી ઇંડાઓને સેવવાનું કાર્ય નર ઇમુ પક્ષી દ્વારા કરવામાં આવે છે. નર ઇમુ દ્વારા સફળતાપુર્વક સેવવાનું કાર્ય કરાતા ૬૦

દિવસના અંતે ઇંડાઓમાં ૦૩ બચ્ચાં ઓનો જન્મ થયેલ. હાલ આ ત્રણેય બચ્ચાંપ ત્રણ માસના થઈ ગયેલ છે અને તંદુરસ્તપ હાલતમાં પાંજરામાં હરતા-ફરતા જોઈને મુલાકાતીઓ પ્રભાવિત થાય છે.

ઇમુ પક્ષીની વિશિષ્ટતા :

ઇમુ પક્ષી વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું ઉડી ન શકતું પક્ષી છે. પ્રથમ નંબરે સૌથી મોટું ઉડી ન શકતું પક્ષી શાહમુગ છે.

સ્થામનિક નામ ઇમુ

કુદરતી રહેઠાણ: ઇમુ પક્ષી ભારતના કોઈ પણ ભાગમાં જોવા મળતું નથી. તેનું કુદરતી રહેઠાણ ઓસ્ટ્રેલિયા, ન્યુઈ હોલેન્ડ તથા ન્યુત જીનીયાના ખુલ્લા મેદાનો ધરાવતા જંગલો, સવાનાના મેદાનો અને સૂકા વિસ્તાથરોમાં જોવા મળે છે.

ખોરાક : આ પક્ષી મિશ્રાહારી હોય, કુણા ઝાડ-પાન, જીવજંતુ, તીડ, ખડમાંકડ, ઇયળો, કિટકો તેમજ જમીન પરના અન્ય નાના જીવજંતુઓ ખાય છે. આ પક્ષીની સામાન્ય ઉંચાઈ ૦૫ થી ૦૬ ફુટ જેટલી હોય, તે ૪૮ કિમી/કલાકની ઝડપે દોડી શકે છે. તેનો સરેરાશ વજન ૩૦ થી ૫૫ કિગ્રા. અને આયુષ્યન ૩૦ થી ૩૫ વર્ષ જેટલું હોય છે.

હાલ ઝૂ ખાતે જુદી જુદી ૫૯ પ્રજાતિઓનાં કુલ-૪૯૦ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનિક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.

ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ
રાજકોટ મહાનગરપાલિકા